

ખાસ અગત્યનું/સમય મર્યાદા

ૐ પરિપત્ર ૐ

વિષય:- “માઈનસ ગ્રાન્ટ સરભર” કરવા બાબત...

નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ કચેરી અને યોજનાઓના વડાશ્રીઓ, નિયંત્રણ અધિકારીશ્રીઓ તેમજ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓને જણાવવાનું કે, અત્રેની કચેરીના તિજેરી વિભાગમાં ઘણી કચેરીઓ દ્વારા જુદીજુદી યોજનાઓના બીલ પાર્સીંગ અર્થે રજુ કરવામાં આવે ત્યારે ગ્રાન્ટ માઈનસમાં હોવાના કારણે બીલો વાંધામાં આપવામાં આવે છે. સદર બીલો પાસ કરાવવા માટે જે તે કચેરી તરફથી વર્ષના અંતે જે તે ફંડિંગ એજન્સી તરફથી માઈનસ ગ્રાન્ટ મેળવી લેવાની શરતે બીલ પાસ કરવા અંગેનું “પ્રમાણપત્ર” ઉપર કચેરી અને યોજના ના વડાશ્રીની ભલામણો મેળવી માઈનસ ગ્રાન્ટના બીલો પાસ કરાવવા અર્થે અત્રેની કચેરીની તિજેરી શાખામાં ફરી રજુ કરવામાં આવે છે અને ભલામણોને ધ્યાને રાખી યોજના ના હેતુઓ સમયમર્યાદામાં સિદ્ધ થઈ શકે તેમાટે માઈનસ ગ્રાન્ટ વાળા બીલો પાસ કરવામાં આવે છે.

તો, ઉપરોક્ત બાબતે જે કચેરીઓ દ્વારા જુદીજુદી યોજનાઓમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં માઈનસ ગ્રાન્ટના બીલો પાસ કરાવવામાં આવ્યા છે, એવી યોજનાઓની ફંડિંગ એજન્સી પાસેથી ઘટતી વધારાની ગ્રાન્ટ ૩૧/૦૩/૨૦૨૨ પહેલા મેળવી માઈનસ ગ્રાન્ટ સરભર કરાવવાની રહેશે. અન્યથા આવનાર નવા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં માઈનસ ગ્રાન્ટ રહેલ હોઈ એવી યોજનાઓના બીલો પાસ કરવામાં આવશે નહીં, જેની સર્વે ખાસ નોંધ લેવી.

ખ.નં. નકૃયુ/હિનિ/કંટ્રોલ/બજેટ/૨૧૦૦/૨૦૨૨
નવસારી, તા. ૧૪/૦૩/૨૦૨૨



હિસાબ નિયામક

નકલ સવિનય રવાના (e-પરિપત્ર દ્વારા):-

- (૧) અત્રેની યુનિવર્સિટીના તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ તરફ જાણ સારૂ.
- (૨) અત્રેની યુનિવર્સિટીના તમામ કચેરી અને યોજનાઓના વડાશ્રીઓ તરફ જાણ તથા અમલ થવા સારૂ.
- (૩) અત્રેની યુનિવર્સિટીના તમામ યોજનાઓના નિયંત્રણ અધિકારીશ્રીઓ તરફ જાણ તથા અમલ થવા સારૂ.
- (૪) અત્રેની યુનિવર્સિટીના તમામ ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીઓ તરફ જાણ તથા અમલ થવા સારૂ.
- (૫) અત્રેની યુનિવર્સિટીના માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી તરફ જાણ સારૂ.

નકલ રવાના (e-પરિપત્ર દ્વારા):-

અત્રેની યુનિવર્સિટીના વહીવટી-વ-હિસાબી અધિકારીશ્રી તરફ જાણ તથા અમલ થવા સારૂ.



Please consider your environmental responsibility. Before printing this circular message, ask yourself whether you really need a hard copy.